

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ



ઘોરણ-૧૦ પછીના રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પોલીટેકનીકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ કાર્યક્રમ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩

ગુજરાત રાજ્યની આણંદ, જુનાગઢ, નવસારી તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પોલીટેકનીકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઘોરણ-૧૦માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રથમ વર્ષ ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ અરજીપત્રક તા. ૦૧-૦૮-૨૦૨૨ થી તા. ૧૭-૦૮-૨૦૨૨ સુધી વેબસાઇટ poly.gsauca.in માં ઓનલાઇન અરજી ફી રૂ. ૨૦૦/- સાથે ભરી શકાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઇન થશે.

પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી gsauca.in, poly.gsauca.in, www.sdau.edu.in, www.aau.in, www.nau.in અને www.jau.in ઉપરથી મેળવી શકાશે. સદર તારીખોમાં ફેરફારને અવકાશ હોઇ રોજ બરોજની છેલ્લી માહિતી ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી મેળવી લેવાની રહેશે. જેની વાલી / વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી.

પોલીટેકનીકમાં ચાલતાં ડિપ્લોમા અભ્યાસક્રમો

૧	કૃષિ ડિપ્લોમા	૪	બાગાયત ડિપ્લોમા
૨	કૃષિ ઇજનેરી ડિપ્લોમા	૫	એગ્રો પ્રોસેસીંગ ડિપ્લોમા
૩	કુડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન ડિપ્લોમા	૬	ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ડિપ્લોમા

- અગત્યની સૂચના :**
- (૧) ડિપ્લોમા અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઇન gsauca.in, poly.gsauca.in, www.sdau.edu.in, www.aau.in, www.nau.in અને www.jau.in વેબસાઇટ ઉપરથી જોઇ / ડાઉનલોડ કરી શકાશે. **અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે ઓનલાઇન માહિતી પુસ્તિકાનો પુરેપુરો અભ્યાસ કરી ફોર્મ ભરવાનું રહેશે.**
 - (૨) ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.
 - (૩) જો ૭-૧૨ અને ૮-અ ના દાખલા ઉપરથી ઉમેદવાર અને જમીનના માલિક જોડેનો સંબંધ સ્પષ્ટ ન થતો હોય તો, તે બન્ને વચ્ચેનો સંબંધ દર્શાવતું પેઢીનામું તેમજ, ઘોરણ-૧૦ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને ૭/૧૨, ૮-અ માં દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનું સોગંદનામું રજુ કરવાનું રહેશે.
 - (૪) દિવ્યાંગજન ઉમેદવારોએ દિવ્યાંગતા અંગેનું સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી / સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડેન્ટનું પ્રમાણપત્ર પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે.
 - (૫) ઉમેદવાર મોકરાઉન્ડ પછી એક જ વાર ચોઇસ ફીલીંગ બદલી શકશે.
 - (૬) ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ મેળવ્યા બાદ ઓનલાઇન ફી ભરવાની રહેશે. **પ્રવેશ મળ્યા બાદ પ્રવેશ રદ કરવામાં આવે તો ફી પરત મળવા પાત્ર નથી.**
 - (૭) ઉમેદવારને ઓનલાઇન પ્રવેશ મળ્યા બાદ ઉમેદવાર આગળના રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો માત્ર ઓનલાઇન ફી જ ભરવાની રહેશે. ઉમેદવારે કોલેજ ખાતે હાજર રહેવાનું રહેતું નથી. **પ્રથમ ચોઇસની કોલેજમાં પ્રવેશ મળતા વિદ્યાર્થીએ કોલેજ ખાતે ફરજિયાત હાજર થવાનું રહેશે.**

તા. 10/07/2022

કુલપતિ અને નોડલ અધિકારી (ડિપ્લોમા અભ્યાસક્રમો)
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી
સરદારકૃષિનગર